

# રાજકોટ મહાનગરપાલિકા

ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

-: અખબારી યાદી:-

ગયા શુક્રવારે બહોળો પ્રતિસાદ મળ્યા બાદ આજે પણ મનપાના અધિકારીઓ/કર્મચારીઓએ મ્યુનિ. કમિશનરશ્રીએ કરેલ અપીલને હૃદયથી આવકારી : સાયકલ પર કે ચાલીને ઓફીસ આવ્યા

‘ઇન્ડિયા સાઈકલ ફોર યેન્જ’ યેલેન્જ અંતર્ગત મનપા સહીત શહેરની અન્ય સંસ્થાઓએ પણ મ્યુનિ. કમિશનરશ્રીની અપીલને આવકારી

હાલ જ કોરોનાને મ્હાત આપીને ફરજ પર પરત ફરેલા અધિકારીઓ પણ ઘરેથી ઓફીસ સુધી ચાલીને આવ્યા

ગઈકાલે સાંજે પણ રાજકોટના પ્રખ્યાત સાયકલીસ્ટ સાથે મ્યુનિ. કમિશનરશ્રી, નાયબ મ્યુનિ. કમિશનરશ્રીએ બી.આર.ટી.એસ. સાયકલ ટ્રેક પર સાઈકલીંગ કર્યું

તારીખ: ૧૬-૧૦-૨૦૨૦





રાજકોટ શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી સ્માર્ટ સીટીઝ મિશન દ્વારા ' ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ ' ચેલેન્જની શરૂઆત કરવામાં આવેલ છે. આ ચેલેન્જમાં રાજકોટ સહીત ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે. શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન મળે, પ્રદુષણમાં ઘટાડો થાય તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ પગલાઓ લઈ રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ / કર્મચારીઓ હવેથી દર શુક્રવારે ઓફિસે આવવા-જવા માટે પોતાના ટુ વ્હીકલ કે ફોર વ્હીકલનો ઉપયોગ ન કરાતા સાયકલ, પૈદલ કે માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે અંગે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે અપીલ કરેલ હતી જેનો ગયા શુક્રવારે મનપાના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો, ઉપરાંત આજે પણ તમામ

અધિકારીઓ/કર્મચારીઓએ મ્યુનિ. કમિશનરશ્રીએ કરેલ અપીલને હૃદયથી સ્વીકારી સાયકલિંગ કરીને અથવા તો ચાલીને ઓફીસ આવ્યા હતા.

આજે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ સહીત નાયબ મ્યુનિ. કમિશનરશ્રી બી. જી. પ્રજાપતિ, શ્રી એ. આર. સિંઘ, શ્રી સી. કે. નંદાણી તેમજ ત્રણેય ઝોનના અધિકારીઓ અને કર્મચારીઓ સાયકલિંગ કરીને ઓફીસ આવ્યા હતા તેમજ આજે મોટી સંખ્યામાં અધિકારીઓ/કર્મચારીઓ પોતાના ઘરેથી ઓફીસ સુધી પૈદલ આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા સહીત શહેરની અન્ય સંસ્થાઓએ પણ મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા કરવામાં આવેલ અપીલને આવકારી હતી જેમાં બીગ બજાર, આન ગ્રુપ ઓફ કંપની, ફોર્ચ્યુન હોટલ, ક્રિસ્ટલ મોલ, રાજકોટ નાગરિક સહકારી, અમૃતા હોસ્પિટલ સહિતની અન્ય સંસ્થાઓના સ્ટાફ પણ આજે ટુ વ્હીકલને બદલે સાઈકલ કે પૈદલ ઓફીસ આવ્યા હતા.

મ્યુનિ. કમિશનરશ્રીએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફ સહીત શહેરની અન્ય સંસ્થાઓ પણ અમારી સાથે જોડાઈ છે. પોતાની સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ આજે સાઈકલ લઈને ઓફીસ આવ-જા કરે છે. લોકો સાયકલિંગ પ્રત્યે વધુ જાગૃત બને અને સાયકલએ ટ્રાન્સપોર્ટેશન માટેના એક સારા વિકલ્પની ઉપલબ્ધિ છે, પર્યાવરણના સંરક્ષણ માટે તેમજ તંદુરસ્ત આરોગ્ય પ્રાપ્ત કરવામાં ઉપયોગી થાય છે.

મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને મ્યુનિ. કમિશનરશ્રીએ અપીલ કરી હતી કે, સપ્તાહમાં એક દિવસ શુક્રવારે ઘરેથી ઓફીસ આવવા – જવા માટે પોતાના વાહનોને બદલે સાયકલ અથવા પૈદલ કે સિટી બસનો ઉપયોગ કરીએ. કર્મચારીઓને અપીલ કરાતાની સાથે મ્યુનિ. કમિશનરશ્રી શરૂઆત પોતાનાથી જ કરેલ હતી. આજે સવારે ૧૦:૧૫ વાગ્યે પોતાના નિવાસસ્થાનેથી સેન્ટ્રલ ઝોન ઓફીસ સુધી સાયકલિંગ કરીને આવ્યા બાદ પોતાની કામગીરીની શરૂઆત કરી હતી.

હાલ જ કોરોના વાઈરસને મ્હાત આપીને પોતાની ફરજ પર પરત આવેલા અધિકારીઓ પણ મ્યુનિ. કમિશનરશ્રીએ કરેલ અપીલને હૃદયથી આવકારી હતી. જેમાં નાયબ આરોગ્ય અધિકારીશ્રી ડો. પંકજ રાહોડ અને જન સંપર્ક અધિકારીશ્રી ભુપેશ રાહોડ આજે પોતાના ઘરેથી ઓફીસ સુધી પૈદલ આવ્યા હતા. ડો. પંકજ રાહોડ ૨.૪૭ કી.મી. અને શ્રી ભુપેશ રાહોડ ૦૬ કી.મી. ચાલીને ઓફીસ આવ્યા હતા. જેઓ હાલ જ કોરોના વાઈરસ સામે લડીને પોતાની ફરજ પર હાજર થયેલ છે.

આ એક ઉમદા ઉદાહરણ છે કે કોવિડ-૧૯ ની સામે છેલ્લા ૬ માસથી દિવસ-રાત જોયા વગર કે રજા લીધા વગર અવિરત કામગીરી કરી છે અને જ્યારે પોતાને કોરના પોઝિટિવ આવ્યો

તો પણ ગભરાયા વિના કોરોનાને મ્હાત આપી તુર્ત જ પોતાની ફરજ સ્વીકારી હતી. સાથોસાથ મ્યુનિ. કમિશનરશ્રીની અપીલને પણ હૃદયથી આવકારી અન્ય લોકો માટે પ્રરણાદાયી બન્યા છે.

ગઈકાલ સાંજે ૦૭:૦૦ વાગ્યે પણ શહેરના પ્રખ્યાત સાયકલિંગ ગ્રુપ જેવા કે રાજકોટ સાયકલ ક્લબ, રાજકોટ રેન્ડોનીયર્સ સાથે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, નાયબ કમિશનરશ્રી બી. જી. પ્રજાપતિ, શ્રી એ. આર. સિંઘ, શ્રી સી. કે. નંદાણીએ બી.આર.ટી.એસ. સાયકલ ટ્રેકની રાઈડ કરી હતી. શહેરીજનો સાયકલિંગ કરે અને સ્પેશિયલ સાયકલિંગ માટે બનાવવામાં આવેલ સાયકલ ટ્રેકનો લોકો વધુને વધુ ઉપયોગ કરે તેમ મ્યુનિ. કમિશનરશ્રીએ કહ્યું હતું.

સાઇકલિંગથી મળશે અનેક ફાયદા

- ટ્રાન્સ્પોર્ટેશન માટેનો એક સારો વિકલ્પ
- પર્યાવરણના સંરક્ષણમાં ઉપયોગી થાય
- સાઇકલિંગ કરનારનું આરોગ્ય સારું રહે

(જન સંપર્ક અધિકારી)  
રાજકોટ મહાનગરપાલિકા